



Gujarat State Athletics Association

AFFILIATED TO: GUJARAT STATE OLYMPIC ASSOCIATION * ATHLETICS FEDERATION OF INDIA

VIVEK P. PATEL
PRESIDENT

LAXMAN V. KARANJGAOKAR
HON. SECRETARY

તારીખ: ૨૨-૦૪-૨૦૨૨

પ્રતિ,
પ્રમુખ/ મંત્રી
તમામસંલગ્નએકમો.

વિષય: ગુજરાત ટીમ ની ૬૧મી નેશનલ ઈન્ટર સ્ટેટ સિનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨- ચેન્નઈ અને ૨૦મી નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર -૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ – નડિયાદ માટે પસંદગી કાર્યક્રમ.

ઉપર વિષય સંદર્ભ સાથે, જણાવવાનું કે ઉપરોક્ત બંને એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માટે ગુજરાત સ્ટેટ એથલેટિક્સ ટીમ પસંદગી રવિવાર તારીખ ૦૧ -૦૫-૨૦૨૨ ના રોજ છોટુભાઈ પુરાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નડિયાદ ખાતે સવારે ૮:૦૦ વાગે આયોજિત કરવામાં આવશે .

• ૬૧મી નેશનલ ઈન્ટર સ્ટેટ સિનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માટે દરેક સહભાગી દ્વારા નીચેની સૂચનાઓ અને માર્ગદર્શિકાને અનુસરવાનું રહેશે.

- સ્પર્ધા માં ઓપન (ખુલ્લા) વિભાગ ના ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે.
- એ.એફ.આઈ-યુ. આઈ ડી ધરાવનાર ખેલાડી જ આ સિલેક્શનમાં ભાગ લઈ શકશે. (એ.એફ.આઈ-યુ. આઈ. ડી. વગર ના ખેલાડીઓ એ નડિયાદ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા આવવું નહીં)
- ખેલાડી ફક્ત બે ઈવેન્ટમાં ભાગ લઈ શકે છે.
- ખેલાડીએ વય ચકાસણી માટે એ.એફ.આઈ-યુ. આઈ. ડી. સાથે લાવવાનું રહેશે.
- એએફઆઈ-નવી દિલ્હી અને પસંદગી સમિતિના અહેવાલ દ્વારા જાહેર કરાયેલા ધોરણ / લાયકાતના આધારે ટીમની પસંદગી થશે.
- રજિસ્ટ્રેશન ફી ખેલાડી દીઠ રૂ .300 / -
- સ્ટેટ એસોસિએશન દ્વારા સિલેક્શન / રાષ્ટ્રીય સ્પર્ધા ખાતે કોઈ રહેવાની સુવિધા આપવામાં આવશે નહીં.
- જે ખેલાડી પાસે ગુજરાત રાજ્ય સિવાયનું યુઆઈડી નંબર હોય તેમણે પસંદગીના દિવસે એએફઆઈ-નવી દિલ્હી નું માન્ય 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' લઈને આવવાનું રહેશે. અન્યથા ભાગ લેવા દેવામાં આવશે નહીં.
- ગુજરાત સરકાર ના કોરોના ની ગાઈડ લાઈન ને અનુસરવું ફરજિયાત હશે.
- સદર સ્પર્ધા ની ૧૦,૦૦૦ મી દોડ સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે તેથી આ ઈવેન્ટ માં ભાગ લેનારા ખેલાડીઓ એ સવારે ૬:૪૫ કલાકે હાજર રહેવા વિનંતી. અન્ય ઈવેન્ટ ૮:૦૦ કલાક પછી શરૂ થશે.

• ૨૦મી નેશનલ ફેડરેશન કપ જૂનિયર અંડર ૨૦ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માટે દરેક સહભાગી દ્વારા નીચેની સૂચનાઓ અને માર્ગદર્શિકાને અનુસરવાનું રહેશે.

- સ્પર્ધા માં 2003, 2004, 2005, 2006 વર્ષ માં જન્મેલા ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે.
- એ.એફ.આઈ-યુ. આઈ ડી ધરાવનાર ખેલાડી જ આ સિલેક્શનમાં ભાગ લઈ શકશે. (એ.એફ.આઈ-યુ. આઈ. ડી. વગર ના ખેલાડીઓ એ નડિયાદ ખાતે સ્પર્ધામાં ભાગ લેવા આવવું નહીં)
- ખેલાડી ફક્ત બે ઈવેન્ટમાં ભાગ લઈ શકે છે.

પાનાં નં. ૧



Gujarat State Athletics Association

AFFILIATED TO: GUJARAT STATE OLYMPIC ASSOCIATION * ATHLETICS FEDERATION OF INDIA

VIVEK P. PATEL
PRESIDENT


LAXMAN V. KARANJGAOKAR
HON. SECRETARY

4. રજિસ્ટ્રેશન ફી ખેલાડી દીઠ રૂ. 200 / -
5. ખેલાડીએ વય ચકાસણી માટે એ.એફ.આઈ-યુ. આઈ. ડી. સાથે લાવવાનું રહેશે.
6. એએફઆઈ-નવી દિલ્હી દ્વારા જાહેર કરાયેલા ધોરણ / લાયકાતના આધારે પસંદગી પામેલા ખેલાડીઓને સ્ટેટ એસોસિએશન દ્વારા પ્રમાણિત કરવામાં આવશે અને તે અંગે પ્રમાણ પત્ર આપવામાં આવશે ત્યાર બાદ ખેલાડીએ જાતે એ એફ આઈ પોર્ટલ પર ઓન- લાઈન એન્ટ્રી અને સ્પર્ધા ફી રૂ. 500/- પ્રતિ ઈવેન્ટ ૨૦ /૦૫/૨૦૨૨ પહેલા જમા કરવાની રહેશે.
7. સ્ટેટ એસોસિએશન દ્વારા સિલેક્શન / રાષ્ટ્રીય સ્પર્ધા ખાતે કોઈ રહેવાની સુવિધા આપવામાં આવશે નહીં.
8. જે ખેલાડી પાસે ગુજરાત રાજ્ય સિવાયનું યુઆઈડી નંબર હોય તેમણે પસંદગીના દિવસે એએફઆઈ-નવી દિલ્હી નું માન્ય 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' લઈને આવવાનું રહેશે. અન્યથા ભાગ લેવા દેવામાં આવશે નહીં.
9. ગુજરાત સરકાર ના કોરોના ની ગાઈડ લાઈન ને અનુસરવું ફરજિયાત હશે.
10. સદર સ્પર્ધા ની ૫,૦૦૦ મી દોડ સવારે ૭:૩૦ કલાકે શરૂ થશે તેથી આ ઈવેન્ટ માં ભાગ લેનારા ખેલાડીઓ એ સવારે ૬:૪૫ કલાકે હજાર રહેવા વિનંતી. અન્ય ઈવેન્ટ ૮:૦૦ કલાક પછી શરૂ થશે.

આથી ઉપરોક્ત સ્થળ અને તારીખ ઉપર જણાવેલ પસંદગીમાં તમારા જિલ્લા ખેલાડીઓ મોકલવા વિનંતી છે. જિલ્લા એથલેટિક્સ એસો. પ્રમુખ અને મંત્રીને ઈલેક્ટ્રોનિક્સ / પ્રિન્ટ અને સોશયલમીડિયા દ્વારા ઉપરોક્ત ચેમ્પિયનશિપનો વ્યાપક પ્રચાર કરવા અનુરોધ કરવામાં આવે છે. આ વિષે ની અન્ય માહિતી માટે આપ રાજ્ય એસસોસીશનને સંપર્ક કરવો.

આભાર.

આપનો વિશ્વાસુ,


લક્ષ્મણ કરંજગાવેકર
સેક્રેટરી

પાનાં નં. ૨